

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન ઓક્ટોબર 9 નાં રોજ ટાઉન હોલમાં સ્થાનિક સંઘીય ઉમેદવારોના યજમાન બનશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 20, 2019) – વર્ષ 2019 ની કેનેડિયન ફેડરલ ઇલેક્શન (સંઘીય ચૂંટણી) પહેલાં, સીટી ઓફ બ્રેમ્પટન રહેવાસીઓ માટે સૌથી મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવા તા. ઓક્ટોબર 9 નાં રોજ ટાઉન હોલમાં સ્થાનિક ઉમેદવારોના યજમાન બનશે.

આ પ્રસંગ જાહેર જનતા માટે ખુલ્લો છે અને સાંજે 7 વાગ્યે રોજ થિયેટરમાં યોજાશે. બેઠકો સીમિત હોવાને લીધે, રહેવાસીઓને [રોજ થિયેટરની વેબસાઈટ પર](#) નોંધણી કરાવવાનું કહેવામાં આવે છે. આ પ્રસંગનું Facebook પર લાઈવ સ્ટ્રીમિંગ (જીવંત પ્રસારણ) પણ થશે.

વર્ષ 2041 સુધીમાં, બ્રેમ્પટનમાં રહેવાસીઓની સંખ્યા 900,000 કરતા વધારે થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. કેનેડાના સૌથી જુવાન અને સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંનું એક હોવાથી, જનતાની અપેક્ષાઓ સાથે મેળ ખાતા વિકાસને સંતુલિત કરવો એ એક પડકાર છે અને એક તક પણ છે.

સરકારના ઉચ્ચતર સ્તરો સાથે પોતાની ભાગીદારીઓ મજબૂત કરીને, સીટી ઓફ બ્રેમ્પટન એવા પ્રોજેક્ટ્સ આગળ વધારવાનો હેતુ ધરાવે છે જેનો લાંબા સમય સુધી આર્થિક પ્રભાવ પડે, નવી નોકરીઓ ઊભી થાય, અને આપણાં રહેવાસીઓ માટે સામુદાયિક ગૌરવ અને જીવનની ગુણવત્તામાં સુધાર લાવે.” આ શહેરની સંઘીય અગ્રતાઓની પૂરી યાદી માટે, [શહેરની વેબસાઈટ](#) જુઓ.

અવતરણ (ક્વોટ):

“આપણે કરેલી પસંદગીઓનો સ્થાનિક મુદ્દાઓ પર નોંધપાત્ર પ્રભાવ પડતો હોય છે – અને આપણને બ્રેમ્પટન માટે અવાજ ઉઠાવે તેવા સ્થાનિક પ્રતિનિધિઓની જરૂર છે. કેનેડાના સૌથી જુવાન અને સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંના એક તરીકે, સંઘીય સરકારની સહાયતા અને ભાગીદારી એ બ્રેમ્પટનની અગ્રતાઓ અને દૂરંદેશીપણાંનું પરિણામ લાવવામાં મહત્વની ભાજત છે. આપણાં સમુદાયમાં ટ્રાન્ઝિટ, આર્થિક વિકાસ, સામુદાયિક સુરક્ષા, નવીન શોધ અને પર્યાવરણલક્ષી પહેલો આગળ વધારવામાં આપણાં ભાગીદારો જે રીતે કટિબદ્ધ થશે તે સંબંધમાં અર્થસભર સંવાદ કરવા અમે આશાવાદી છીએ.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમા 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूहान्मक संवाट

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca